

જનસંપર્ક અધીકારી દ્વારા  
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર  
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩  
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૫/૦૫/૨૦૧૬ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૩૩/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૬ કેસ કરી, ૨૮ વ્યક્તિઓને ઝડપી, ૭૯ લીટર દેશી દારૂ, ૩ ઈંગ્લીશ દારૂ અને ૨ બિયર ટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૪ વ્યક્તિઓને ઝડપી રૂપિયા ૭૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૩૪/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

બળાત્કારની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૮૩૫/૧૬

બાપુનગર :- બાપુનગર વિસ્તારમાં રહેતી ૨૭ વર્ષની પરણીતાએ બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩/૫/૧૬ બપોરનાં ૧/૦૦ વાગ્યાના સુમારે ઘર નજીક રહેતો આરોપી ચિરાગ જીતુભાઈ પરમાર નાનો પરણીતાનાં ઘરે આવી, પરણીતાનાં પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપી, બળજબરીથી પરણીતાની મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધ્યો હતો તેમજ ઘરમાં તીજોરીમાંથી સોના-ચાંદીનાં દાગીના અને રોકડા રૂપિયા ૪૪,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૨૨,૦૦૦/- મતા બળજબરીથી કઢાવી લઈ ગયો છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી.આર.એમ.ગામીત ચલાવે છે.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૮૩૬/૧૬

સરદારનગર : સતીષકુમાર હર્ષદભાઈ પટેલ (રહે.આશ્રય ફ્લેટ, ઇન્દીરાબ્રીજ પાસે, હાંસોલ) એ તા.૪/૫/૧૬ નારોજ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આશરે સવા વર્ષ અગાઉથી આજદિન સુધીનાં સમયગાળા દરમ્યાન આરોપી (૧) નીરજકુમાર પ્રેમકુમાર (૨) પ્રેમકુમાર અદલખા (બંને રહે.ઇન્દીરાબ્રીજ ની બાજુમાં, સરદારનગર) ભેગામળી સતીષકુમારને વિશ્વાસમાં લઈ, તેમની પાસેથી કુલ રૂપિયા ૮૦,૦૦,૦૦૦/- મેળવી, સતીષકુમારે પૈસાની ઉઘરાણી કરતાં, જાનથી મારી નાંખવાની ધમકી આપી, પૈસા પરત નહીં ચુકવી, સતીષકુમારે સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી.વી.આર.પટેલ ચલાવે છે.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૮૩૭/૧૬

ઓઢવ : હરીઓમસિંગ ઉદયવિરસિંગ સેગલ (રહે.અરીહતબાગ સોસાયટી, આદિનાથનગર ઓઢવ) ઁ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોઢાવી છે કે તા.૪/૫/૧૬ નાં કલાક ૧/૩૦ થી ૫/૩૦ વાઝ્યા દરમ્યાન પોતાના મકાનના દરવાજાનુ તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી સોના-ચાંદીનાં દાગીના અને રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૫૬,૯૫૨/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી ઁસ.એમ.પટેલ ચલાવે છે.

સોનાની ચેઇન ખેંચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૮૩૮/૧૬

સાબરમતી : પ્રીતીબહેન મોહનભાઇ કુમ્માન (રહે.ગ્રીનવીલા રેસીડન્સી, યોગીનગરની સામે, ડી કેબીન સાબરમતી) તા.૪/૫/૧૬ સાંજના ૫/૧૫ વાઝ્યાના સુમારે “ડી” કેબીન ઓમનગર વિભાગ-૧ સામે આવેલ કિશ્ના ડેરી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઁક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ પ્રીતીબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૧,૨૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ પ્રીતીબહેન કુમ્માને સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે નોઢાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી કે.એમ.છાસીયા ચલાવે છે.

નજર ચુકવી ચોરી :-

સમાચાર યાદી નં.૮૩૯/૧૬

મણીનગર : રક્ષાબહેન પંકજકુમાર ત્રિવેદી (ઉ.વ.૫૬)(રહે.ન્યુ આરતી સોસાયટી, વૈભવ હોલ પાછળ, કેનાલ રોડ, ઘોડાસર) તા.૨/૫/૧૬ સવારના ૧૧/૩૦ થી ૧૧/૪૫ વાઝ્યા દરમ્યાન ઘોડાસર રાજબાગ સોસાયટી થી મણીનગર રામબાગ ચાર રસ્તા સુધીની ઓટોરીક્ષાની મુસાફરી દરમ્યાન રીક્ષાનો ડ્રાઇવર તેમજ રીક્ષામાં બેસેલ ઁક સ્ત્રી અને બે પુરૂષે રક્ષાબહેનની નજર ચુકવી, ગળામાં પહેરેલ સોનાની ચેઇન કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- ચોરી કરી લઈ ગયા છે. આ અંગેની ફરીયાદ રક્ષાબહેન ત્રિવેદીઁ તા.૪/૫/૧૬ નારોજ મણીનગર પોલીસ સ્ટેશન ખાતે નોઢાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.ઁસ.ખરાડી ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૮૪૦/૧૬

“ઁન” ઢ્રાફીક પોલીસ સ્ટેશન: સ્મીત મુકેશભાઇ કિશ્ચીયન (રહે.શ્રીમાન ઁપાટમેન્ટ, પટેલવાડી, ખોખરા સ્નાનાગર સામે, મણીનગર) ઁ “ઁન” ઢ્રાફીક પોલીસ સમક્ષ ફરીયાદ નોઢાવી છે કે તા.૪/૫/૧૬ સવારનાં ૬/૦૦ વાઝ્યાના સુમારે ચંદ્રનગર રોડ, આંબેડકરબ્રીજનાં મધ્ય ભાગે પોતાના મિત્ર સ્મિથ જોન્સનભાઇ કિશ્ચીયન (ઉ.વ.૨૦)(રહે.લાલભાઇ સેન્ટર, ઁડનપાર્ક, મણીનગર) નાઓનાં મોટર સાયકલ પાછળ બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઇ કારણસર બાઇક ફેંકાઇ જતાં, બંને જણા ઉછળીને સામેનાં રોડ ઉપર પડી ગયા હતા. દરમ્યાન ઁક અજાણ્યા સ્ટાફ બસનાં ચાલકે, બસ પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી લાવતાં, પોતાના મિત્ર સ્મિથ ઉપર પાછલુ વ્હીલ ચઢી જતાં, શરીરે ગાંભીર ઈજાઓ થતાં, સારવાર માટે તેમને વા.સા.હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૪/૫/૧૬ બપોરનાં ૨/૦૦ વાગે સ્મિથ જોન્સનભાઇ કિશ્ચીયનનું મૃત્યુ નિપજયું હતુ. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી બી.ઁમ.લશ્કરી ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૮૪૧/૧૬

શહેરકોટડા: ભરતભાઈ ઉર્ફે ભુપેન્દ્ર પુંજાભાઈ રાઠોડ (ઉ.વ.૩૫)(રહે.ત્રીકમલાલની ચાલી નિર્મળપુરા ચાર રસ્તા સરસપુર) એ કોઈ કારણસર તા.૩/૫/૧૬ રાતના ૧૦/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી, આ અંગેની તપાસ હે.કો.શ્રી નરેન્દ્રસિંહ રતનસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.